

“ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવતા રીસર્ચ રીપોર્ટના

છાપકામ માટેની શરતો તથા જોગવાઈઓ, સને-૨૦૧૭-૧૮

- ૧) છાપકામ માટે સારી ગુણવત્તાવાળું અને અત્રેથી સૂચિત કરવામાં આવે તે રૂએ નીચે મુજબની માહિતી પ્રમાણે કરવાનું રહેશે.

Title	Size	No. of pages	No. of copies
Carbon storage –Coral Reefs	8X11.5	124+4	250
Ecology of Coral Reefs	11X8.5	236+4	250
GHG Emissions	9X13	216+4	250
Regional Climate variability	9X13	124+4	250

- ૨) ઇનર પેજ - ૧૦૦ જીએસએમ આઈ પેપર અને કવર પેજ - ૧૭૦ જીએસએમ આઈ પેપર(કાગળ)લેમિનેશન સાથે હાર્ડ બાઈન્ડીંગ સિલાઈ સાથે કરી અત્રેની કચેરી ખાતે પહોંચાડવા સાથેના ભાવ આપવાના રહેશે.
- ૩) અત્રેથી લેખિતમાં વિગતે ઓર્ડર આપ્યેથી દિન-૧૦ માં કામગીરી પૂર્ણ કરી કચેરી ખાતે નકલો પહોંચતી કરવાની રહેશે.
- ૪) ઉપર જણાવ્યા મુજબ ચાર રીપોર્ટનું એક-એક સેમ્પલ બનાવી તૈયાર કર્યા બાદ આ કચેરીના અધિકારીશ્રીને બતાવીને ફાઈનલ માટે મંજૂરી મેળવવાની રહેશે.
- ૫) તમામ માલસામાન, પ્રિન્ટીંગ, બાઈન્ડીંગ, મંજૂરી સહિતનાં ભાવો “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની કચેરી ખાતેના તમામ વેરા-સેવાઓ સહિતના ભાવ ભરવાના રહેશે.
- ૬) અત્રેથી આપેલ ડીઝાઈન મુજબ માપ, સાઈઝ પ્રમાણે સંતોષકારક અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી આપવાની રહેશે.
- ૭) કામગીરીનાં ખર્ચનાં ચૂકવણામાં જો ટીડીએસની કપાત હશે તો તે નિયમસર કપાત કરવામાં આવશે.
- ૮) અર્નેસ્ટ મની રૂ.૧૦,૦૦૦/- (શબ્દોમાં રૂપિયા દસ હજાર પુરા) ભર્યા સિવાયનું ટેન્ડર સ્વીકાર્ય ગણાશે નહીં. અર્નેસ્ટ મનીનો ડીમાન્ડ ડ્રાફ્ટ “નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર” ના નામનો ટેન્ડરની સાથે સામેલ કરવાનો રહેશે.
- ૯) ટેન્ડરની મુદત દરમ્યાન શરતો મુજબ સંતોષકારક રીતે કામગીરી પુરી પાડેલ હશે તો, મુદત પૂર્ણ થયેથી અર્નેસ્ટ મની ડીપોઝીટ પેટે ભરેલ રકમ પાછી આપવામાં આવશે, અર્થાત્ સંતોષકારક નહી જણાયે અમલવારી રદ કરી, અર્નેસ્ટ મની ડીપોઝીટ જમ કરવામાં આવશે.
- ૧૦) ટેન્ડર અંગે ઉભા થતા કોઈપણ કાયદાકીય ગુંચ કે તકરારનો નિર્ણય સબબ અપીલ સત્તાધિકાર નિયામકશ્રી “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરને રહેશે. ત્યારબાદ ગાંધીનગર કોર્ટની હુકમતમાં રહેશે.(સબજેક્ટ ટુ ગાંધીનગર જ્યુરીડિક્શન)
- ૧૧) કામગીરી પૂર્ણ કરી બિલ બનાવીને કચેરીને રજુ કરવાનું રહેશે. સંજોગોવસાત મુદ્દત બહાર બિલ મળવા પામશે તો ચૂકવણા અંગે વિલંબ કે વાદ-વિવાદની કોઈપણ તકરાર ચાલશે નહિ.
- ૧૨) પાનકાર્ડ/ ટીન નંબર/ સર્વિસ ટેક્ષ નંબર તથા અન્ય સરકારી મંજૂરીઓની ઝેરોક્ષ નકલો ટેન્ડર સાથે બીડવી જરૂરી છે.

- ૧૩) ભૂતકાળમાં સરકારશ્રીમાં **ઓછામાં ઓછા ૧૦ લાખનું કામ હાથ ધરાયું હોય તો તેના** આદેશની ઝેરોક્ષ નકલો ટેન્ડર સાથે બીડવી જરૂરી છે.
- ૧૪) વખતો વખત અન્ય કોઈ શરત કે સૂચના અત્રેથી મૂકવામાં આવે તો તે **ઈજારદાર/ઈસમ/પેઢીને** બંધનકર્તા રહેશે.
- ૧૫) ટેન્ડર કોઈપણ કારણ જણાવ્યા સિવાય મંજૂર/નામંજૂર કરવાની કે જરૂર જણાયે અઘવચ્ચે હુકમ રદ કરવાની સત્તા નાયબ નિયામકશ્રી, સંશોધન અને વિકાસ, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની રહેશે.
- ૧૬) ગુણવત્તા, ભૂતકાળમાં ગીર ફાઉન્ડેશન સરકારશ્રીમાં કામનો અનુભવ, છેલ્લા વર્ષમાં ઓછામાં અને ભરેલ ભાવોના આધારે મૂલ્યાંકન કરી પાર્ટી નક્કી કરવાની આખરી સત્તા નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની રહેશે.
- ૧૭) ટેન્ડર કોપીમાં સૂચિત કરેલ બાબતો/શરતો/જોગવાઈઓ અનુસાર બંધ કવરમાં ભાવો ભરી, સૂચિત કરેલ તારીખ સુધીમાં કવર ઉપર **“સીસીપી-રીસર્ચ રીપોર્ટ અંગેના છાપકામના ભાવો”** લખી આર.પી.એડી./ સ્પીડપોસ્ટથી અત્રે મોકલી આપવાના રહેશે.